


# મારું હદય

વર્ષ-૪, અંક-૪૫, ૧૫ ઓક્ટોબર, ૨૦૧૩



Care Institute of Medical Sciences



Price ₹ 5/-

## કાર્ડિયોલોજીસ્ટ

ડૉ. અજય નાઈક	+૯૧-૯૮૨૪૦ ૮૨૬૬૬
ડૉ. સત્ય શુના	+૯૧-૯૮૨૪૦ ૪૫૭૮૦
ડૉ. વિનીત સાંખલા	+૯૧-૯૮૨૪૦ ૧૫૦૫૬
ડૉ. ગુણવંત પટેલ	+૯૧-૯૮૨૪૦ ૬૧૨૬૬
ડૉ. કેયૂર પરીખ	+૯૧-૯૮૨૪૦ ૬૬૬૬૪
ડૉ. મિલન યગ	+૯૧-૯૮૨૪૦ ૨૨૧૦૭
ડૉ. ઉર્મિલ શાહ	+૯૧-૯૮૨૪૦ ૬૬૫૩૮
ડૉ. ડેમાંગ બક્સી	+૯૧-૯૮૨૪૦ ૩૦૧૧૧
ડૉ. અનિશ ચંદ્રાશા	+૯૧-૯૮૨૪૦ ૮૬૫૨૨

## કાર્ડિયોક સર્જન

ડૉ. ધીરેન શાહ	+૯૧-૯૮૨૪૫ ૭૫૮૩૩
ડૉ. ધવલ નાયક	+૯૧-૯૦૮૮૯ ૧૧૧૩૩

## પીડિયાટ્રીક અને સ્ટ્રોક્યર્લ હાર્ટ સર્જન

ડૉ. શૌનક શાહ	+૯૧-૯૮૨૪૦ ૪૪૫૦૨
--------------	-----------------

## વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જન

ડૉ. સૃજલ શાહ	+૯૧-૯૧૩૭૭ ૮૮૦૮૮
--------------	-----------------

## કાર્ડિયોક એન્થેરીસ્ટ

ડૉ. નિરેન ભાવસાર	+૯૧-૯૮૭૮૫ ૭૧૭૧૭
ડૉ. હિરેન ધોળકિયા	+૯૧-૯૮૮૬૩ ૭૫૮૧૮
ડૉ. વિંતન શેઠ	+૯૧-૯૧૭૩૨ ૦૪૪૫૪

## પીડિયાટ્રીક કાર્ડિયોલોજીસ્ટ

ડૉ. કશ્યપ શેઠ	+૯૧-૯૮૨૪૬ ૧૨૨૮૮
ડૉ. મિલન યગ	+૯૧-૯૮૨૪૦ ૨૨૧૦૭

## નીઓનેટોલોજીસ્ટ અને

## પીડિયાટ્રીક ઇન્ટેન્સીવીસ્ટ

ડૉ. અમિત ચિત્તલીયા	+૯૧-૯૦૮૮૮ ૮૭૪૦૦
--------------------	-----------------

## કાર્ડિયોક ઇલેક્ટ્રોફિઝિયોલોજીસ્ટ

ડૉ. અજય નાઈક	+૯૧-૯૮૨૪૦ ૮૨૬૬૬
--------------	-----------------

# રૂભ દિવાલી



સીમ્સ હોસ્પિટલ સર્વે વાયકોને દિવાળીની શુભ કામનાઓ પાઠવે છે. નવા વર્ષમાં તમારું આરોગ્ય તંદુરસ્ત રહે તેવી આશા સહ...

- સીમ્સ પરિવાર



## નાનાં બાળકોના હદ્યના રોગો

ડૉ. મિલન ચગ મારા સહકર્મી છે અને સ્થિરિયર કાર્ડિયોલોજિસ્ટ છે. તેઓ પુખ્ત વયના તેમ જ બાળકો બંને માટેની કાર્ડિયોલોજીમાં વિશેષતા ધરાવે છે. આ પ્રશ્નોત્તરી સ્વરૂપમાં તેઓએ કન્જેનિટલ હાર્ટ ડિસીસ વિશે જગ્ઘાવવાની નમૃતા દાખવી છે.

### કન્જેનિટલ હાર્ટ ડિસીઝ (સીએચડી) શું છે ?

સીએચડી એ જન્મથી જ બાળકમાં જોવા મળતી હદ્યની અસામાન્યતાઓનું એક જૂથ છે.

### આપણા દેશમાં કોણેનિટલ હાર્ટ ડિસીઝનું પ્રમાણ કેટલું છે ?

જન્મ લેતાં દર ૧૦૦ બાળકો દીઠ એક બાળકને સીએચડી હોઈ શકે છે.

**શું સીએચડી ધરાવતાં બાળકોનું સમયસર નિદાન અને સારવાર થાય છે ? શું આ રોગ પ્રાણઘાતક છે ?**

એ આપણી કમનસીબી છે કે, દર વર્ષે સીએચડી સાથે જન્મ લેતાં બે લાખ બાળકો પૈકી માત્ર ૫૦૦૦ બાળકોનું જ સમયસર નિદાન અને સારવાર થાય છે. આ માટેનું કારણ એ છે કે માતાપિતાઓ અને સમાજ સીએચડીની નિશાનીઓ અને લક્ષણથી વાકેફ નથી. જો આવા રોગોનું જન્મ પછી બહુ ટંકા સમયમાં નિદાન ન થાય તો આવાં બાળકો પૈકીના ઉત્ત ટકા બાળકો એક વર્ષ પૂરું કરતાં પહેલાં મૃત્યુ પામે છે.



### સીએચડીની ચિહ્નો અને લક્ષણો શું છે ? કેવા કેસ અંગે પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટે તાકીદે ધ્યાન આપવું જરૂરી છે ?

દરેક માતાપિતા, ફેમિલી ડોક્ટર અને પીડિયાટ્રિશિયને નવજાત શિશ્યાઓમાં નીચેની બાબતોનું નિરીક્ષણ કરવું જોઈએ. જો આવા ચિહ્નો અને લક્ષણો જગ્ઘાય તો બાળકની પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ દ્વારા તપાસ થવી જોઈએ.

- ◆ ઝડપી શ્વાસોશ્વાસ
- ◆ પૂરતા પ્રમાણમાં ખવડાવવી (સ્તનપાન કરાવવાની) શકવાની અક્ષમતા
- ◆ બાળક વાદળી અથવા ભૂખરા રંગની છાંટ ધરાવતું હોવાનું દેખાય છે.

- ◆ બાળક ઘણું વધારે પડતું નબળું, ફિઝ્કું અથવા અશક્ત જગ્ઘાય છે.
- ◆ અત્યંત વધારે પડતી ખાંસી અથવા વારંવાર છાતીમાં ચેપ થવો.
- ◆ સ્તનપાન કરાવતી વખતે વધારે પડતો પરસેવો.
- ◆ વધારે પડતું રૂદ્ધન.
- ◆ બાળકનું વજન વર્ધતું નથી અથવા તેનું જોર વધતું નથી અથવા તેનો શારીરિક વિકાસ ધીમો છે.
- ◆ કોઈ પણ ડોક્ટર દ્વારા ક્રિલનિકલ તપાસમાં હદ્યનો વધારાનો અવાજ અથવા ગણગણાટ જોવા મળે.
- ◆ માપવામાં આવતાં ઓક્સિજન સેચ્યુરેશન ઓછું જગ્ઘાય.
- ◆ જો છાતીનો એક્સ-રે કરાવવામાં આવે તો હદ્યનું કદ મોટું જોવા મળે.
- ◆ છીલ્લાં ત્રણ લક્ષણો જન્મ બાદ તેમની તપાસ દરમ્યાન તબીબો દ્વારા તપાસવામાં આવે છે.



### કન્જેનિટલ હાર્ટ ડિસીઝના પ્રકાર કયા છે? દરેક કેસમાં ઓપરેશન જરૂરી છે ?

સામાન્ય રીતે સીએચડીમાં સાંકડો વાલ હોઈ શકે અથવા હદ્યની ચેમ્બર્સ વચ્ચે કોઈ ભાગ ખુલ્લો હોઈ શકે. ઉપરાંત હદ્યમાં લોહી લાવતી અને લઈ જતી રક્તવાહિનીઓ મોટી રક્તવાહિનીઓ ખોટી જગ્ઘાયાએ આવેલી હોઈ શકે અથવા રક્તવાહિનીઓ પૂરતા પ્રમાણમાં વિકસી ન હોઈ શકે. તમામ પ્રકારના સીએચડી માટે ઓપરેશન જરૂરી નથી. સાંકડા વાલ અથવા સાંકડી રક્તવાહિનીઓને ઓપરેશન વગર બલૂન ઓન્જિયોપ્લાસ્ટી વડે પહોળા કરી શકાય છે. તે જ રીતે હદ્યની ચેમ્બર્સ વચ્ચેના ખુલ્લા ભાગને ઓપરેશન વગર કોઈલ્સ અથવા અમબ્રેલા સાધનો વડે બંધ કરી શકાય છે. આવી સારવારમાં કોઈ કાપા કરવામાં આવતા નથી કે સ્ટીસીચ લેવામાં આવતા નથી અને છિત્તાં બાળક સાજો થઈ જાય છે અને આવી સારવાર બાદ સામાન્ય જવન જવી શકશે.



એવી સામાન્ય માન્યતા છે કે બાળક માટે હદ્યનું ઓપરેશન કે સારવાર કરવા માટે તેનું વજન ૧૦ કિલો કરતાં વધારે હોવું જરૂરી છે અને તે પાંચ વર્ષથી વધારે મોટું હોવું જોઈએ. શું આ સાચું છે?

ના. આ એક અત્યંત ગંભીર અને કમનસીબ ગેરસમજ છે. દરેક બાળકની તેની સીએચડીની ગંભીરતા અનુસાર સારવાર કરવામાં આવે છે. બાળક માત્ર એક દિવસનું હોય અને તે માત્ર ૨ કિલો વજન ધરાવતું હોય તો પણ જો તેની સ્થિતિ માટે તાત્કાલિક સારવાર જરૂરી હોય તો તે આપી શકાય છે અને આપવી જ જોઈએ. જો સારવારમાં વિલંબ કરવામાં આવે તો કેટલાક કેસોમાં, રોગ અસાધ્ય બની શકે છે અને બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે.

આવા રોગો માટેનાં કારણો શું છે?

મોટા ભાગના કેસોમાં સીએચડી ગર્ભના વિકાસના કુદરતી કમ દરમ્યાન થાય છે. કેટલાક કેસોમાં કોમોજોમલ અસામાન્યતાઓ હોઈ શકે (રંગસૂત્રીય), અથવા સગર્ભાવસ્થા દરમ્યાન વાઈરલ ઈન્ફેક્શન થયું હોઈ શકે. સીએચડી કેટલીક દવાઓની આડઅસરનું


પરિણામ પણ હોઈ શકે.

તેનું વહેલું નિદાન કેવી રીતે થઈ શકે?

આવા રોગોનું વહેલું નિદાન કરવાનો એકમાત્ર ઉપાય માતાપિતા, ફેમિલી ડોક્ટર્સ અને પીડિયાટ્રિશિયનના પક્ષે જાગૃતિ અને સતર્કતાનો છે. આવા તબીબો આવા રોગોના પ્રાથમિક લક્ષણોથી વાકેફ હોવા જોઈએ અને પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટની બહુ વહેલી સલાહ લેવી જોઈએ.

જો કોઈ કુટુંબમાં એક બાળકને સીએચડી હોય તો તે જ કુટુંબમાં અન્ય બાળકને સીએચડી હોવાની શક્યતા છે?

કુટુંબના કોઈ એક બાળકને સીએચડી હોય તેવા કેસમાં, તે કુટુંબમાં બીજા બાળકને સીએચડી હોવાની શક્યતા ર થી ત ટકા જેટલી છે. આવા કેસોમાં, બીજા બાળકની ડિલિવરીપૂર્વ સગર્ભાવસ્થાના ૧૮ થી ૨૦માં સપ્તાહ દરમ્યાન, સીએચડીનું નિદાન કરવા ગર્ભના હદ્યની ઈકોકાર્ડિયોગ્રાફી તપાસ કરી શકાય છે.



દર્દીઓને નીચેના માટે નિઃશુલ્ક સેવાઓ પૂરી પાડવામાં આવશે:

- (૧) કન્સલ્ટેશન (૨) એબીઆઈ
- (૩) ટોપ્લાર (આર્ટીરીયલ અથવા વેરીકોઝ વેઈન્સ - જો સૂચવવામાં આવે તો)

## એન્ડોવારસ્ક્યુલર પેરિફેરલ વર્ક્શૉપ

સીમ્સ અને અગ્રાણી આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા

છેલ્લા કેટલાક વર્ષોથી સીમ્સમાં મોટી સંખ્યામાં કોરોટીડ ઇન્ટરવેન્શનનું સહિત અનેક એન્ડોવારસ્ક્યુલર કેસ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૮-૧૦, ૨૦૧૪

નીચેના લક્ષણો ધરાવતા દર્દીઓ આ વર્ક્શૉપમાં ભાગ લઇ શકશે

- કોરોટીડ આર્ટરી સ્ટેનોસીસ
- રેનલ આર્ટરી સ્ટેનોસીસ
- એક્સ્યુટ લીભ ઈસ્કેમિયા
- ક્રીટીકલ લીભ ઈસ્કેમિયા
- વેરીકોઝ વેઈન્સ
- ડાયાલિસીસ એક્સેસ પ્રક્રિયાઓ
- પલ્મોનરી એભોલીઝમ
- થોચસીક આઉટલેટ સિન્ટ્રોમ
- યૂટેનીન ફાર્ટ્બોર્ડિઝુસ
- વાસ્ક્યુલર માટ્કોર્નેશન્સ
- વીનસ ઈન્સફ્રીન્શન્સ અને વીનસ અલ્સર
- ક્લોડિકેશન
- એઓરટોલિઓક ઓક્લુઝીવ ડિસીઝ
- ફિઝોરોપોલ્સીટલ ડિસીઝ
- બ્રેક્યોસેફ્લાલિક આર્ટીરીયલ ડિસીઝ
- વીનસ થોભોએભોલિક ડિસીઝ
- થોરસિક એભોમિનલ એચોટીક એન્યુરીઝમ
- મેસેન્ટેરીક ડિસીઝ
- કેથેટર આધારીત ઇન્ટરવેન્શન નિષ્ફળ હિમોડાયાલિસીસ એક્સેસ માટે
- ઈન્ફાપોલ્સીટીલ પેરિફેરલ આર્ટીરીયલ ડિસીઝ
- ઈન્ટ્રાકેનિયલ આર્ટીરીયલ સ્ટેનોટીક ડિસીઝ
- વર્ટીબ્રલ આર્ટીરીયલ ડિસીઝ


સંબંધિત દર્દીઓ માટે દૈનિક તપાસ\* ઓક્ટોબર ૧, ૨૦૧૩થી સીમ્સ હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે. સમય: બપોરે ૨ થી સાંજે ૬

\*તપાસ માટે એપોઇન્ટમેન્ટ લાઇન આવવું જરૂરી છે. ફોન : +૯૧-૭૯-૩૦૧૦ ૧૦૦૮/૩૦૧૦ ૧૨૦૦

## હદ્યના વાલ્વ બાદલવા

હદ્યમાં ચાર વાલ્વ અથવા પડદા હોય છે. તેમનું કામ છે કે હદ્યમાં લોહી યોગ્ય દિશામાં જાય તેની ચોકસાઈ રાખવી. ક્યારેક હદ્યના વાલ્વને જે રીતે કામ કરવું જોઈએ. તે રીતે નથી કરતા. આથી અમુક પ્રકારની તકલીફો થઈ શકે. દા.ત., હદ્યના વાલ્વમાં જન્મથી જ ખામી હોય, અને તેમને સમારકામની જરૂર પડે છે. બેંકટેરિયલ એન્ડોકાર્ડિટિસ જેવા ચેપી રોગ હદ્યના વાલ્વને ઈજા પહોંચાડી શકે. અથવા તેનો સંપૂર્ણ નાશ કરી શકે. વૃદ્ધાવસ્થા પણ હદ્યના વાલ્વ ઉપર અસર કરે છે.

હદ્યના વાલ્વના રોગથી વાલ્વ કઠણા થઈ જાય છે, તેથી તે યોગ્ય રીતે ખૂલ્યી ન શકે તથા લોહીના સરળ અને પૂરતા પ્રવાહ ઉપર અસર થાય છે. આ પ્રકારની સ્થિતિને “સ્ટેનોસિસ” કહેવામાં આવે છે. હદ્યનો કોઈ વાલ્વ જ્યારે અશક્ત બની જાય, અથવા ખેંચાઈ જાય ત્યારે તે બરાબર બંધ થઈ શકતો નથી અને આ લીકેજને “રિગર્ઝટેશન” કહેવામાં આવે છે.



હદ્યના જુદી જુદી જાતના ફૂંક્રિમ વાલ્વ

હદ્યના વાલ્વમાં કોઈ પણ તકલીફ થવાથી હદ્ય ઉપર વધારે કામનું દબાણ આવે છે. તે વધારાનું કામ કરવા માટે હદ્ય કદમાં મોટું થતું જાય છે. થોડા સમય માટે હદ્ય તેના વાલ્વની ખામીને આ રીતે પહોંચી વળે છે. ધીમે ધીમે હદ્ય કદમાં ખૂબ જ મોટું થઈ જાય છે અને હદ્યના સ્નાયુને નુકસાન પહોંચી શકે છે, જેના કારણે હદ્ય બંધ પડી જાય છે.

### ખામીઓના પ્રકાર અને તેનું સમારકામ

સામાન્ય રીતે હદ્યના વાલ્વ જે જગ્યાએ સામસામે અડે છે, તે જગ્યાએ ચોંટી જવાથી સાંકડા થઈ જતા હોય છે. ધાર વડે કાપી નાંખવાથી આ પ્રકારનો અવરોધ દૂર કરી શકાય. આનાથી વાલ્વ એકબીજાથી છૂટા પડી જાય છે અને તેમને સહેલાઈથી હલવામાં મદદ મળે છે. ફુંગા (વાલ્વ્યુલોપ્લાસ્ટી) વડે પણ વાલ્વને ખુલ્લા કરી શકાય.



વાલ્વનો કોઈ ભાગ ઢીલો અથવા લાંબો થઈ જવાથી ઘણી વખત વાલ્વમાંથી લોહી ઊંધી દિશામાં ફેંકાય છે. વાલ્વના છેડા, જે સામાન્ય રીતે બંધ થવા માટે અડે છે, તે એકબીજાની બાજુમાંથી સરકી જાય છે, અને લોહીને વાલ્વમાં થઈને ઊંધી દિશામાં વહી જવા દે છે. જેમ સમય પસાર થાય અને ખાવ વધતો જાય, તેમ આખા વાલ્વનું કદ મોટું થતું જાય છે. પરિણામે, વાલ્વની પાંખો એકબીજાથી દૂર થતી જાય છે અને ક્યારેય અડતી નથી. વાલ્વ તેનું કાર્ય યોગ્ય રીતે કરે તે માટે આ પ્રકારના વાલ્વનું સમારકામ કરાવવું જોઈએ.

મારી દિકરી માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે અને મેડિકલ સ્ક્રુલમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કરે છે.

તેના અને ડોક્ટર વચ્ચે શું તફાવત છે?

તેઓ બંને સમાન છે...

તેઓ સખત મહેનત કરે છે, ઓણું ખાય છે અને પૂરતી ઊંઘથી વંચિત છે... જો કે સ્ક્રુલમાં તમારે આ બધું કરીને જે કિમત ચૂકવી પડે છે એના બદલામાં આશા રાખવાની કે એક દિવસ તમને કોઈ આ કિમત પાછી ચૂકવશે.



### ખામીઓને કઈ રીતે સુધારી શકાય છે?

હદ્યના વાલ્વની સારવાર કરવી કે નહીં, અને કરવી તો કઈ રીતે કરવી તેનો આધાર રોગની તીવ્રતા ઉપર રહે છે. અમુક લોકો જ્યાં સુધી તેમને નિયમિત તબીબી સલાહ અને તપાસ મળતી રહે, ત્યાં સુધી સામાન્ય જિંદગી જીવી શકે છે. વધારે માઠા સંજોગોમાં શસ્ત્રક્રિયાની જરૂર પડી જાય છે. સાંકડા



થયેલા અમુક વાલ્વની મરામત કોથેટરથી હસ્તક્ષેપ કરીને અથવા શસ્ત્રક્રિયા વડે કરી શકાય છે.

## વાલ્વ બદલવાની શસ્ત્રક્રિયાઓ

જ્યારે હદ્યના વાલ્વ ગંભીર રીતે બગડે અથવા ઘસાઈ ગયા હોય, ત્યારે ફક્ત તેમનું સમારકામ કરવાથી ન ચાલે. ઈજા પામેલા જૂના વાલ્વને કાઢીને નવા વાલ્વ લગાવવામાં આવે છે. તે મુખ્યત્વે બે પ્રકારના હોય છે.



બાયો પ્રોસ્થેટિક વાલ્વ

## માંસપેશીના અથવા જૈવિક વાલ્વ


આ વાલ્વ રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર કરેલા પશુઓના વાલ્વ હોય છે. તેમને કપડાથી ઢાંકેલી ધાતુ અથવા પ્લાસ્ટિકની ફેમમાં બેસાડવામાં આવે છે, જેથી તેમને હદ્યની અંદર પેસાડવા સહેલા બને. આ વાલ્વ થોડાં જ વર્ષો ચાલે છે પણ શરીરને વધુ માફક આવે છે, અને એની આજુબાજુ લોહી જામી જતું નથી.

## ચાંપ્રિક અથવા કૃત્રિમ વાલ્વ

તે ટકાઉ ધાતુ, કાર્બન, સિરામિક (માટી) અને પ્લાસ્ટિકમાંથી બનાવેલા હોય છે. ડેકોન અથવા ટેફ્લોનની રિંગ વડે આ પ્રકારના વાલ્વને દર્દીના હદ્ય સાથે જોડવામાં આવે છે. આ પ્રકારના વાલ્વનો મુખ્ય ફાયદો એ છે કે તે ખૂબ જ ટકાઉ છે. તેમનો ગેરફાયદો એ છે કે, તેમની આજુબાજુ લોહી જામી જવાની શક્યતા રહે છે.

વાલ્વની પસંદગી ધણી બાબતો પર આધાર રાખે છે. સર્જન દર્દીની ઉંમર, વાલ્વને થયેલ ઈજાનું પ્રમાણ, વાલ્વનું કદ, અને દર્દી જીવનભર લોહી ન જામે તે માટે દવા લઈ શકે તેમ છે કે નાઈ - એ બધી બાબતો ધ્યાનમાં લેશે.

## કેલ્સીઝીક એસ્ટોટિક સ્ટેનોસિસ



- \* લોહી થયેલું
- \* બેઢેંગું વાલ્વ
- \* કેલ્સીઝીઝિંડ (કડક)

## હદ્યના પડદાની શસ્ત્રક્રિયાના ફાયદાઓ

હદ્યના વાલ્વના રોગવાળા દર્દીઓ ખૂબ જ પડકારબરી જિંદગી જીવે છે. હદ્યના વાલ્વની શસ્ત્રક્રિયા તેમને વધારે સારી જિંદગી જિવાડવાનું વચ્ચે આપે છે. આ પ્રકારની શસ્ત્રક્રિયા પછી સામાન્ય રીતે દર્દી એવાં ઘણાં કાર્યો કરે છે કે જે તે તેમના માટે તે પહેલાં અશક્ય હતા. પહેલા મહિનાથી જ તેમની જિંદગી સુધરતી જાય છે.

## હાર્ટ વાલ્વની વિકાસગાથા

### હાર્ટ વાલ્વ

\* વાલ્વને એ રીતે બનાવવામાં આવે છે, જેથી તે હદ્યમાં થઈને વહેતા લોહીને એક જ દિશામાં વહેતું રાખવા ઉપર કાબૂ રાખે.

\* માનવીના હદ્યમાં જ વાલ્વ હોય છે.

બે વાલ્વ એટ્રીઓવેન્ટ્રીક્લ્યુલર (એવી) તરીકે ઓળખાય છે - જે લોહીને એટ્રીઆ થઈને વેન્ટ્રીક્લીસ તરફ વહેતું રાખે છે - તેનાથી ઊલટું નહીં. બે વાલ્વ સેમિલ્યુનર વાલ્વ તરીકે ઓળખાય છે - જે હદ્યને છોડીને રક્તવાહિનીઓમાં હાજર હોય છે અને તે લોહીને રક્તવાહિનીમાંથી વેન્ટ્રીક્લ તરફ જતું રોકે છે.

\* હાર્ટ વાલ્વ અંગે થતા રોગના ઉપયોગ

પરકુટેનેએસ એપ્રોચ (વિના સર્જિકલ વિકલ્પ)

સર્જિકલ વિકલ્પ (વાલ્વની ફેરરચના, વાલ્વને બદલી નાખવો.)

## વાલ્વની જાતો અને પસંદગી

વાલ્વની પસંદગી કરવી એ અત્યંત અટપટી પ્રક્રિયા છે. તે અંગે ઘણી વાતો ધ્યાન પર લેવી જોઈએ.

- ◆ દર્દીને થયેલા રોગની હાલત
- ◆ દર્દીની ઉંમર
- ◆ દર્દીની જીવનશૈલી



વાલ્વ બદલવાની જરૂરત છે કે કેમ તે જણાવતી વાતો.  
સખત નબળાઈ અથવા સખત અપૂર્ણતાનો ભાવ.

## મિક્રોનિકલ વાલ્વ

તે સંપૂર્ણપણે સિન્થેટિક વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. (જેવી કે મિશ્રધાતુઓ, પ્લાસ્ટિક)



Ap360 સુપ્રા-અન્યુલર



એરોટિક વાલ્વ ગ્રાફ્ટ

## ટિસ્યૂ વાલ્વ

ત્રણ પ્રકારના ટિસ્યૂ વાલ્વ હોય છે.

- ◆ હોમોગ્રાફ્ટ : માનવીના ‘મૃત્યદેહ’માંથી તેને ઉત્પન્ન કરવામાં આવે છે અને માનવીમાં જ તેનું આરોપણ કરવામાં આવે છે.
- ◆ પોરસીને વાલ્વ : બંદુકમાંથી તે ઉત્પન્ન કરવામાં આવે છે.
- ◆ પેરાકાર્ડિઅલ વાલ્વ : તાજા જન્મેલા વાઇરડાના પેરાકાર્ડિઅલ ટિસ્યૂમાંથી તેની રચના કરવામાં આવે છે.




સૌપ્રથમ કેસમાં સહનુભૂતિપૂર્વક TAVI કરવામાં આવેલ ઉપયોગ કાર્ડિયોઝેનિક શોકવાળા દર્દને આપવામાં આવ્યો, સર્જરીનો ઉપયોગ કર્યા વગર.

## પરક્યુટેનીએસ વાલ્વ રિપ્લેસમેન્ટ TAVI

• કેથેટર આધારિત વાલ્વુલર બીમારીની સારવાર ૧૯૮૨થી અસ્તિત્વમાં છે, પરંતુ હવે આ દર્દાઓ સાથેના નવા અનુભવો વિશ્વમાં રજૂ કર્યું છે. • આ શરૂઆતનાં કાર્યો સૌથી પહેલા સફળ કેથેટર આધારિત સ્ટેન્ટ વાલ્વ માનવ શરીરમાં મૂકવાનું કાર્ય ૨૦૦૦ની સાલમાં બોનહોફરે પુલ્મોનિક વાલ્વમાં કર્યું અને સૌથી પહેલું સફળ માનવ ‘કેથેટર આધારિત ઓપરેશન કર્યા વગર એરોટિક વાલ્વ બદલવાની પ્રક્રિયા ડૉ. કિબીએ ૨૦૦૨માં કરી હતી.



નવો ઉકેલ




Edwards - Sapien  
એડવર્સ-સેપિએન  
Corevalve  
કોરેવાલ્વ

Edwards Transcatheter AVR  
(એડવર્સ વાલ્વ)



હળવેથી અને કમ વાર ઉપયોગમાં લેવામાં આવે તો ફરીથી તે સારી રીતે ગોઠવાઈ જઈ શકે છે.



પહેલા વાલ્વ છોડી રહ્યા છીએ વાલ્વ છોડ્યો

## TAVI (ઓપરેશન વગર વાલ્વ બદલવાની ટેક્નિક)

### અંગેના નિષ્કર્ષો

\* જે દર્દાઓને તીવ્ર વાલ્વ સાંકળો હોય તેવા દર્દાઓના જીવના જોખમ વખતે (તાવી) એટલે કે “ટ્રાન્સ-કેથેટર એરોટિક વાલ્વ ઇમ્લાન્ટેશન” શક્ય છે અને સલામત પણ છે.

\* તરત જ અને જલદીથી નોંધપાત્ર વાલ્વ કાર્યક્ષમતામાં સુધારો થવાથી દર્દના દર્દની ટૂંકા ગાળાની આગાહી શક્ય બને છે.

\* સર્જરી ન કરાવી હોય તેવા દર્દાઓમાં રૂઢિગત ઓપરેશનના સ્થાને TAVI ખરેખર ચચિયાતી વાત છે.

\* આ વાલ્વમાં હજી સુધારાઓની શક્યતાઓ છે !

## સૌજન્ય

‘હદ્યની વાત દિલથી’ - લેખક : ડૉ. કેયૂર પરીખ



## વર્લ્ડ હાર્ટ દે

સીમ્સ હોસ્પિટલ દ્વારા તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ વર્લ્ડ હાર્ટ દે દિવસ નિમિત્તે હાર્ટ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં GMERS મેડિકલ કોલેજ, સોલાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો.

વોકના અંતે વોકમાં આવેલ દરેક વ્યક્તિને નિઃશુલ્ક બદલ પ્રેશરની તપાસ અને બદલ સુગર ટેસ્ટ કરવામાં આવ્યા હતા.



## સીમ્સ જોઇન્ટ રીપ્લેસમેન્ટ ડીપાર્ટમેન્ટ

દ્વારા



જોઇન્ટ  
રીપ્લેસમેન્ટ સર્જરી  
₹ ૧.૨૧ લાખથી  
શરી

સીમ્સમાં નિયમિત ચેકઅપ માટે આવનાર દર્દી અથવા તેના સંબંધી માટે જોઇન્ટ રીપ્લેસમેન્ટ વિશેષજ્ઞ દ્વારા

### નિઃશુલ્ક ધૂંટળાના તથા થાપાના સાંધાની તપાસ

સીમ્સ હોસ્પિટલમાં  
જોઇન્ટ રીપ્લેસમેન્ટ વિશેષજ્ઞ  
દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશનનો લાભ લો  
આ કાર્ટિંગ સાથે લાવવું આવશ્યક છે.

ડૉ. ચિરાગ પટેલ (મો) +૯૧-૯૮૨૫૦ ૨૪૪૭૩ સવારે ૧૧ થી ૩ વાગ્યા સુધી (11 am-3 pm) ગુરુવાર અને શાન્દિવાર
ડૉ. અમીર સંઘર્ષી (મો) +૯૧-૯૮૨૫૦ ૬૬૦૧૩ સવારે ૧૧ થી ૩ વાગ્યા સુધી (11 am-3 pm) મંગળવાર, બુધવાર અને શુક્રવાર
ડૉ. અતીત શર્મા (મો) +૯૧-૯૮૨૪૦ ૬૧૭૬૬ સવારે ૧૧ થી ૩ વાગ્યા સુધી (11 am-3 pm) બુધવાર અને શુક્રવાર
ડૉ. હેમંગ અંબાણી (મો) +૯૧-૯૮૨૫૦ ૨૦૧૨૦ સવારે ૧૧ થી ૩ વાગ્યા સુધી (11 am-3 pm) સોમવાર, ગુરુવાર અને શાન્દિવાર

"Maru Hriday" Registered under RNI No. GUJGUJ/2009/28044

Published 15<sup>th</sup> of every month

Permitted to post at PSO, Ahmedabad-380002 on the 22<sup>nd</sup> to 27<sup>th</sup> of every month under  
Postal Registration No. GAMC-1731/2013-2015 issued by SSP Ahmedabad valid upto 31<sup>st</sup> December, 2015  
Licence to Post Without Prepayment No. CPMG/GJ/101/2012 valid upto 30<sup>th</sup> June, 2014

If undelivered Please Return to :

CIMS Hospital, Nr. Shukan Mall,  
Off Science City Road, Sola, Ahmedabad-380060.  
Ph. : +91-79-2771 2771-75 (5 lines)  
Fax: +91-79-2771 2770  
Mobile : +91-98250 66664, 98250 66668

'મારુ હદ્ય' નો અંક મેળવવા અંગો : જો તમારે 'મારુ હદ્ય' નો અંક જોઈતો હોય તો તેની કિંમત રૂ ૬૦ (૧૨ અંક) છે. તેને મેળવવા માટે કેશ અથવા ચેક/ડીડી 'સીમ્સ હોસ્પિટલ પ્રા. લી.' ના નામનો તમારા નામ અને તમારા પુરતા એફ્રેસની વિગત સાથે અમારી આફિસ, "મારુ હદ્ય" ડિપાર્ટમેન્ટ, સીમ્સ હોસ્પિટલ, શુકન મોલ નજુક, ઓફ સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦ પર મોકલી આપશો. ફોન નં. : +૯૧-૭૯-૩૦૧૦ ૧૦૫૮/૧૦૬૦

## નિઃશુલ્ક સીપીઆર શીખો અને એક જિંદગી બચાવો (કાર્ડિયોપલ્બોનરી રેસસીટેશન/કાર્ડિયાક મસાજ)

- ♥ શું તમારી આજુ-બાજુ કોઈનું હદ્ય એકાએક બંધ પડી ગયું છે?
- ♥ કોઈ બેહોશ થઈ ગયું છે?
- ♥ કોઈનો શ્વાસ રંધાઈ ગયો છે?

સીમ્સ હોસ્પિટલ દર મહિનાના  
પછેલા રવિવારે ર કલાક માટે  
નિઃશુલ્ક સીપીઆરનાં કલાસનું  
આયોજન કરે છે.

સમય: સવારે ૧૦ થી ૧૨  
રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો  
(મો) ૯૧ ૯૦૯૯૦ ૬૬૫૨૮



સીપીઆર એટલે હુદયની ગતિ બંધ પડી હોય એવા વ્યક્તિને  
આપવામાં આવતી ટાંકાલિક સારવાર પ્રક્રિયા કે જે કોઈપણ  
સામાન્ય વ્યક્તિ શીખી અને અપનાવી શકે છે?

 **CIMS**<sup>®</sup>  
Care Institute of Medical Sciences  
At CIMS... We Care

સીમ્સ હોસ્પિટલ, શુકન મોલ નજુક,  
ઓફ સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ - ૩૮૦ ૦૬૦  
ઈ-મેઇલ: info@cims.me, વેબ: www.cims.me

તંત્રી, મુદ્રક અને પ્રકાશક ડૉ. અનિશ ચંદ્રગણાએ સીમ્સ હોસ્પિટલ વતી હસ્પિટલ પ્રિન્ટરી, ૧૫/૧, નાગરોરી એસ્ટેટ,  
ઇ.એસ.આઇ. ડિસ્પેન્સરીની સામે, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૪ ખાતેથી ધાણું અને  
સીમ્સ હોસ્પિટલ, શુકન મોલ નજુક, ઓફ સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦ ખાતેથી પ્રસિદ્ધ કર્યું.